

Arfin India Limited

February 14, 2024

To.

BSE Limited

Corporate Relation Department,

Phiroze Jeejeebhoy Towers, Dalal Street,

Mumbai - 400001, Maharashtra, India.

Scrip Code: 539151

Security ID: ARFIN

ISIN: INE784R01023

Subject:

Subject: Publication of Newspaper Advertisements - Unaudited Financial Results

for the Ouarter Ended December 31, 2023

Reference:

Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements)

Regulations, 2015

With reference to the subject matter and pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, we wish to inform you that the Board of Directors of the Company at its meeting held on February 13, 2024 has inter alia approved the Unaudited Financial Results of the Company for the Quarter and nine months Ended December 31, 2023. The aforesaid Financial Results were published in the following newspapers:

1. Economic Times (English Language)

2. Nav Gujarat Samay (Gujarati Language)

A copy of the results published is attached herewith. These are also being made available on the website of the company at www.arfin.co.in. .

You are requested to take the same on your record.

Thanking you,

For Arfin India Limited

Mahendra R. Shah

Chairman & Whole Time Director

DIN: 00182746

Encl.: As above

Plant / Factory:

Plot No. 118 / 1,2,3 & 117 / 3,6,7, Ravi Industrial Estate,

B/h. Hotel Prestige, Billeshwarpura, Chhatral,

Tal. - Kalol, Dist. - Gandhinagar - 382729, Gujarat, India.

Ph.: +91-2764-232620 Fax: +91-2764-232620

Registered & Corporate Office:

Plot No. 117, Ravi Industrial Estate,

B/h. Hotel Prestige, Billeshwarpura, Chhatral, Tal. - Kalol, Dist. - Gandhinagar - 382729, Gujarat, India.

Ph.: +91-2764-232621 Fax: +91-2764-232620

Email: info@arfin.co.in

CIN No.: L65990GJ1992PLC017460

Novelis may **Take Bridge** Loans for **Higher Capex**

Hindalco MD says Novelis plans to spend \$4.1 billion on its Bay Minette project in US

Nikita Periwal

Mumbai: Novelis Inc may

Mumbd: Novells Inc may have to take bridge leans for at least a year to fund the increased capital expenditure for its Bay Mimette project in the US, said Satish Pai managing director at Hindulen Industries. Novells, a subsidiarry of Aditya Birta Group company Hindaleo, plans to spend \$41 hillion on the integrated recycling and rolling plant in Bay Mimette, up from \$2.7\$2.8 billion estimated earlier. The aluminium producer and recycler had initially planned to fund this capita the roll aluminium producer and recycler had initially planned to fund this capita through internal accurate. ternal accruals.

Most of the cost overrun

Most of the cost overrun has bappened due to higher has bappened due to higher costs. Palsaid from call with reporters on Tuesday to discuss December quarter results. The size of the bridge loans has yet to bef-nalised, he sidded. The Bay Minette facility, slated to open in the second half of 2028, will initially have a capacity of 809,000 tornes, of which 809,000 will be for cans and the rest for automather products.

plant's capacity
While the cost of production for the first 600,000 ton
nes will be about \$7,000 per
tonne, the cost of brownfield expansion — for the



He said Novells currently has a net debt to operating profit ratio of 2.7 lines, and the company plans to mainth in the teange of 2.6.30. Hindacks are profit surged 7.3 s from a year earlier in the December quarter to e.2.331 crone despite a slight drop in sales to 522.8% crore.

The cost of production for aluminium in India fell 3's sequentially in the December quarter of the cost of the company of the comp

HOTEL TO COME UP IN DOMESTIC TARIFF AREA

GIFT City Invites Bids for Maiden Ultra-luxury Hotel

Mumbai: The Gujarat International Finance Tee-City Company Ltd (GIFTCL) has invited bids to build the first ultra-luxury toled in the domestic tariff area of GIFT City with at least 300 keys and development rights for at least 600,000 sq.ft.

Kallash Babar

Mumbai: The Gujarat International Finance
The Guyarat Inter SIX years prior to the manuscusers of the all references of the allotting development rights has been finalised at £1.600 per sq. ft for the proposed 600,000 sq. ft. The bids are expected to be submitted online by February 20 and physically by February 21. The bidder is also required to have bidder is also required to submitted the state of five-star category or above with at least 250 rooms. It is also required to submitted undertaking that the ultra-luxury hotel will be



ARFIN INDIA LIMITED

Registered & Corporate Office: Plot No.117, Ravi Industrial Estate, Behind prestige Hotel, Billeshwarpura, Chhatral, Gandhinagar-382729, Gujarat, India CIN: L65990GJ1992PLC017460: Phone: +91 2764 232621 Email: investors@arfin.co.in; Website: www.arfin.co.in

EXTRACT OF THE STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2023

(₹ in Lakhs Except Per Share Data)

Sr. No.	Particulars	Quarter Ended		Nine months Ended	
		31-Dec-2023	31-Dec-2022	31-Dec-2023	31-Dec-2022
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Revenue From Operations (Inclusive of GST)	13,369.92	13,632.24	46,143.38	44,730.36
2	Net Profit / (Loss) for the Period (Before Tax, Exceptional and / or Extraordinary Items)	213.56	238.34	769.14	793.49
3	Net Profit / (Loss) for the Period Before Tax (After Exceptional and / or Extraordinary Items)	213.56	238.34	769.14	793.49
4	Net Profit / (Loss) for the Period After Tax (After Exceptional and / or Extraordinary Items)	198.75	237.53	604.05	772.52
5	Total Comprehensive Income for the Period [Comprising Profit / (Loss) for the Period (After Tax) and Other Comprehensive Income (After Tax)]	198.75	237.53	604.05	772.52
6	Paid Up Equity Share Capital (Face Value of ₹ 1/- Each)	1,589.24	1,589.24	1,589.24	1,589.24
7	Other Equity (Excluding Revaluation Reserves as shown in the Audited Balance Sheet)	1.15	- 20	82	
8	Earnings Per Share (Before & After Extraordinary Items) (Face Value of ₹1/- Each)				
	Basic (₹)	0.13	0.15	0.38	0.49
	Diluted (₹)	0.13	0.15	0.38	0.49

Notes: The above is an Extract of the Detailed Format of Quarterly/yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full Format of the Quarterly Financial Results is available on the website of BSE Limited at www.bseindia.com and on the Company's website at www.arfin.co.in

Mahendra R. Shah Chairman & Executive Director (DIN: 00182746)

Tooling, Dies and Mould Industr special

Indian tooling industry surges; eves continued growth

Get pivotal insights and opportunities related to the Indian tooling industry at the upcoming Die Mould India exhibition

he Indian tooling industry is on a high growth phase, and it is expected that this growth will continue in the coming days as well. The global tooling industry and the Indian tooling industry have been growing steadily post the pandemic. While the elobal tool room industry global tool room industry stood at USD 80 billion in 2021 post-Covid-19, the total market size of the tool room industry in India is estimated to be ~Rs 23,600 crore. Interestingly, ~34 per cent of the tooling demand is met the tooling demand is met through imports with ~80 per cent of the imports from China, South Korea, Japan, and Taiwan. ~15 per cent of tooling production in India is exported ~ USA, Spain, Mexico, and Germany are major export destinations. The share of Commercial The share of Commercia Tool Rooms (CTRs) in total demand grew at -8.1 per cent and Captive Tool Rooms

grew at ~ 1.5 per cent, while imports have been almost stagnant with minor changes. "The tooling industry plays a critical role in the

nufacturing value chain by providing dies and moulds needed for and moulds needed for mass production of various parts and thereby forms the backbone of industrial growth. It is extremely important for any nation to have a strong tooling industry in order to make the overall manufacturing industry stronger's said Devaryor M stronger," said Devaraya M Sheregar, president, TAGMA

The Indian tool room industry faces several challenges that affect its growth and competitiveness, such as the skill gap between the training centres and the industry, the high cost and difficulty of financing advanced machinery and software, the lack of concurrent engineering





and collaboration with the and collaboration with the OEMs, and the lack of an outsourcing ecosystem among the tooling suppliers. These challenges prevent the Indian tool room industry from producing precision tools and moulds that can

Place: Chhatral

Date: 13th February, 2024

tools and moulos that can meet the changing demar and expectations of the global market. Commenting on the growth, D Shanmugasundram, vice president, TAGMA, says, The tooline industry in The tooling industry in India is at a crossroads. The manufacturing sector The manufacturing sector in India is poised to grow significantly in the near future and the demand for tools will increase in order to support the higher volumes of production. However, the Indian toolmakers need to invest in skill development, technology upgradation, and technology upgradation, and capacity enhancement." To bolster the industry's

global competitiveness, TAGMA has enacted strategic measures to encourage collaboration and knowledge sharing with international counterparts. The association proactively partners with overseas associations, fostering joint events and initiatives to facilitate the exchange of industry insights, technological advancements, and best practices on a global scale. Furthermore, the uncoming 13th Dia the upcoming 13th Die Mould India International Exhibition promises to offer toolmakers, technology providers, service bureaus, and raw material suppliers an unparalleled platform for networking, knowledge for networking, knowledge exchange, and business connections. This event serves as an ideal ground for fostering collaborations and staying abreast of the latest developments in the in-



DMI 2024 PARTNERS

Gold



✓ AUTODESK Design & Make Platform

Silver



"Precision Redefined, Molds Perfected."



The Injection Mold Makers

INAUGURATION CEREMONY

- Chief Guest



Shri. Uday Samant ister of Ministry of Hon'ble Cabinet Mil Industries (Maharashtra) Govt. of Maharashtra



Shri. Sachin Kulkarni Director - Corporate Procurement & Member of Board, Skoda Auto Volkswagen India Pvt. Ltd.



Mr. Jim Walsh Vice President - Tooling,



Mr. D. M. Sheregar Devu Tools Pvt. Ltd.



Vice President Mr. D. Shanmugasundaram S & T Engineers (P) Ltd.



ગૃહમંત્રી અમિત શાહનો સાણંદ પ્રવાસ એકાએક રદ થતાં મુખ્યમંત્રીની હાજરીમાં તમામ કાર્યક્રમ યોજાયા

નળકાંઠાનાં 39 ગામોમાં કેનાલથી નર્મદાનું પાણી પહોંચાડવા ₹402 કરોડનાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

■ નળકાંઠાના ૩૯ ગામોમાં કેનાલ મારઠતે નર્મદાનું સિંગાઇનું પાણી પર્સોચાડવાના પ્રથમ તબક્કાના ૪૦૨ કરોડના ખાતમુહૂર્ત સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું, નળકાંઠામાં સિંચાઇની સુવિધાના ૪૦ વર્ષ જુના પ્રશ્નનું નિરાકરક્ષ લાવવા અલગ અલગ ચાર કેનાલો મારફતે પાણી પહોંચાડાવાના કુલ ૧૪૨૯ કરોડના પ્રોજેક્ટ પુરા થયા બાદ ૩૫ તજાર હેક્ટર જમીનનો સિંચાઇનો લાભ મળશે. આ પ્રસંગે સાલંદમાં બનનારા પી.એમ.આવાસ યોજનાના હપક આવાસોનો ડ્રો, ૧૨.૮૧ કરોડના ખર્ચે ગહીયા તળાવના બ્યુટિકિકેશનનું ખાતમુકૂર્ત, ખરીદવેચાલ સંઘના ભવન અને ગોડાઉનોનું ખોત મુહૂર્ત સહિત અનેક યોજનાઓનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાપણ

સુવિષાથી વંચિત ૭૯ ગામોને નર્મદાની વિવિષ



ચાર લાંચ કેનાલોમાંથી પાઇપલાઇન મારકતે પાણી પતોંચાડાના ૧૪૨૯ કરોડના પ્રોજેક્ટ પૈકી પ્રથમ તબક્કાના ૪૦૨ કરોડના કામનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ છારોડી પાસેની સાણંદ બ્રાન્ચ કેનાલ ખાતે કેનદ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે રખાયો હતો જો કે દિલ્હીના એક કાર્યક્રમમાં હાજર રહેવાનું હોવાથી અમિતભાઇશાહે સાશંદનો પ્રવાસ દુંકાવતા તમામ કાર્યક્રમો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમ કરાયું હતું. ચોજાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે સી સાલંદના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈની પ્રથમ રોલા ખાતે ઔડા ફ્રારા ૪૨,૧૩ કરોડના ખર્ચે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું હતું.

કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર છ ગોડાઉનો પહોંચાડવાના પ્રથમ તમકાના ૪૦૨ કરોડના કરોડના ખર્ચે ગરિયા તળાવના મ્યુરિકિકેશનનું કેનાલના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ખાતમુહૂર્ત તેમજ સાશેદમાં ૮૩.૫૧ કરોડના ખર્ચ આ કાર્યક્રમ બાદ યોજાયેલા જાતેર સભારોતામાં નિર્માણ પાયનાટા ઓડાના હપદ્ આવાસોનો ડ્રો પહાલામાં ત્રથમ તત્રણના ૪૦૨ કડાડમાં કોલાલા ક્રામીનું ભાગવું કો રચામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ યોજાયેલા જાતેર સ્થારોતામાં મુખ્યમંત્રી ભૂપેનુસ્થાઇ પટેલે જલાવ્યું હતું કે જાયકાંદમાં ખેડૂતોની ૪૦ વર્ષ જૂની માગલીઓને આ વિસ્તારના સંભેદ અને દેશના ગુલ્યંગી અમિતાભાઇ શાહે ભ્યાને હતેને ૧૪૪૯ કરોડના ખર્ચ અમિતાભાઇ શાહે ભ્યાને હતેને ૧૪૪૯ કરોડના ખર્ચ મંજુર કર્યો છે તે તેમની દીર્ય દૃષ્ટિ છે. આ યોજનાથી સાલંદ,બાવળા અને વિરમગામના ૩૯ ગામોની ૩૫ હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ગાંધીનગર સાંસદને દેશની સૌથી વધુ લોકપ્રિય સાંસદ બનાવવા માટે

કરોડના વિકાસ કામો કર્યા છે અને આજે એક જ કર્ષો હતો. આ ઉપરાંત ૧.૨૦ કરડોના ખર્ચે ટોરેન્ટ દ્વારા કેશરડી તળાવના બ્યુટિકિકેશનનું ખાતમુદુર્ત, તેમજ એસ.પી.રિંગ રોડ પર ઓંગણજ જંકશન પર ૭૬.૬૧ કરોડના ખર્ચે બનનારા અંડર પાસનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં સાણેદના પારાસભ્ય કનુખાઇ પટેલ, વિરમગામ પારાસભ્ય હાર્દિક પટેલ,વટવા પારાસભ્ય બાખુસિંહ જાદવ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને અગ્રણીઓ

સુરતમાં ₹200 કરોડના ખર્ચે 100 એકર જમીન પર હાઇ પર્ફોમન્સ સેન્ટર બનશે

આયોજન માટે સરકારની તૈયારી વચ્ચે કલેકટરે દરખાસ્ત ગાંધીનગર મોકલાવી

■કેન્દ્ર સરકાર દ્વારા આગામી 2036માં દેશમાં ઓલિમ્પિક ગેમ્સનું યજમાન પદ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં ારી માટે પ્લાનિંગની રૂપરેખા તૈયાર કરાઈ રહી છે. તેની સાથે હવે સુરતમાં પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા હારા ખેલાડીઓ માટે ઓતરરાષ્ટ્રીય સ્તરની મુવિધાઓ સાથે 200 કરોડ રૂપિયાના ખર્ચે હાઈ પર્કોમેન્સ સેન્ટર બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ખજોદ ખાતે આવેલા ડાયમંડ બુર્સની પાછળ બ્લોક નં. 177થી નોંપાયેલી

જમીન પર પસંદગી ઉતારવામાં આવી છે. 100 એકર જમીનની કાળવણી પણ દૂર થશે સંદાર્મે જિલ્લા કલેક્ટરે દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકાર સમક્ષ મોકલી

ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી સુરતમાં હવે ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખીને વૈત્રિક સ્તરીય સુવિધાઓ મળી રહે તે માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પહેલ કરવામાં આવી છે. શહેરના છેવાડે આવેલા ખજોદમાં 100 એકર જમીન મેળવવા માટે જિલ્લા રમત ગમત અધિકારીએ જિલ્લા કલકેટર સાથે સંકલનમાં કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં સાકાર થનાર ઓતરરાષ્ટ્રીય હાઈ પર્કોમન્સ સેન્ટર, ખાસ ઓલિમ્પિક ગેમ્સના આયોજનના ભાગરૂપે તૈયાર કરવામાં આવશે. ખેલાડીઓના રહેવાથી માંડીને યોગા, મેડિટેશન, ક્રિઝિયોલેરાપી અને ફ્રિટનેશ સેન્ટર સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ તેમાં ઉપલબ્ધ

જિલ્લા કલેકટરે આ માટે બજોદમાં ાજલ્લા ક્લેક્ટર આ માટ સ્વાદમાં આવેલી બ્લોક નં 17?વાળી જમીન નક્કી કરીને તેના સંદર્ભ જુરી સર્વેની કામગીરી હાથ ધર્યા બાદ દરબાસ્ત તૈયાર કરીને ગાંધીનગર મોકલવામાં આવી છે. આ અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લેશે અને ત્યારભાદ સુરતના આંગણે પણ સ્તરના ખેલાડીઓની વૈત્રિક સ્તરીય સુવિધાને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરનું હાઈ પર્કોમેન્સ સેન્ટરની કામગીરીનો

અમેરિકાએ રશિયન હીરાની પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકાતાં સુરતના હીરા ઉદ્યોગ માટે મુશ્કેલીનો સંકેત

» પહેલી માર્ચથી પ્રતિબંધ લાગશે, તેની સીધી અસર પડવાનો ઉદ્યોગકારોને ભય

વિશ્વભરમાં વ્રથમેર મિટી તરીકે પોતાની ઓળખ િયાળરમાં પ્રયુપ્ત સહિરા તેવા સહિરા પ્રદેશ ઉભી કરનાર સુરત શહેરના હીચ ઉદ્યોગ હાલમાં કપર કાળમાંથી પસાર થઈ રહ્યો છે, જોકે, હજી વધુર સંકટના વાદળો ઘેરાય તેવી સ્થિતિ ઉદભવી છે. પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના હીરાની તમામ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આનેકારણે સુરત હીરા

ઉદ્યોગને કરોઇ રૂપિયાનું નુકસાન ઘાય તેવું જોવાય રહ્યું છે. સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરત હીરા ઉદ્યોગ પર સ્પષ્ટપણે જોવા અસર હવ સુરત હારા જ્યાંગ પર સ્પષ્ટપાલ જાવા મળશે, પહેલી માર્ચ 202મી અમેરિકા રશિયાના રક પ્રયમ્પેક્સમી ત્રી તેશ કોઈ પણ ક્રયમંડ પ્રોડસ્ક પ્લિકિંડો નહીં, તેની ઉપર પ્રતિબંધ પૂક્લામાં આવ્યો છે, આ નિર્ણયને કારણે છેલ્લા પણા સમયથી મંદીમાંથી પસાર થઈ રહેલા સુરત પ્રયમેક ઇન્દ્રદ્વિપ્તને માટે પડતા ઉપર પાટ જેવો ધાટ થાય તેમ છે.

આ પ્રતિબંધના કારશે સુરત હીરા ઉદ્યોગને વેપારમાં 35 ટકાનો કટકો પડી શકે તેવી ગણતરી મંડાઈ છે. અમેરિકાના ઓફિસ ઓફ ફોરેન એસેટ કેટ્રોલ દ્વારા આ પ્રતિભંધી કરમાવવામાં આવ્યા છે. અમેરિકાએ રશિયાની અલરોઝા રફ ડાયમેંડ કંપની ઉપર તો પ્રતિબંધ મૂક્યો જ છે. આ કંપનીમાંથી દર મહિને બે લાખ કેરેટ ડાયમેંડ ઈમ્પોર્ટ થય છે, પરંતુ છેલ્લા એક મહિનાથી પ્રતિબંધના કારણે તેની સૌથી સુરત સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. તેમાં આ નવા પ્રતિબંધો વધારે મુશ્કેલી સર્જશે, તેવું હીરા ઉદ્યોગના અગ્રણીઓનું માનવું છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કાસ્ત્રે અમેરિકા

રશિયામાં ઉત્પાદિત વસ્તુઓ પર સતત પ્રતિબંધ લગાવી રહી છે, ખાસ કરીને રશિયાની ખાણમાંથી આવતા રફ ડાયમંડથી તૈયાર થતી જવેલરી ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. તવે એક કેરેટ કે તેનાથી પણ વધુ વજનના પોલિકડ ડાયમંડ ઉપર અમેરિકામાં પહલ માર્ચથી પ્રતિષંધ લાગુ થશે. સૌથી અગત્યની વાત છે કે સુરત પાતળી સાઈઝના કે રફ ડાયમંડ હોય છે તે રશિયા

મિક્સ ગુડ્ઝ તરીકેની છટકબારી પણ બંધ થશે

ନିଲେ ଧୁଲେ ପରି ଚଳଚ୍ଚିତ୍ର ଅଧିକ୍ର ଅଧିକ୍ର ଅଧିକ୍ର ମଧ୍ୟ କରିଥି । ଅଧିକ୍ର ଅଧିକ୍ୟ ଅଧିକ୍ର ଅଧିକ ଅଧିକ୍ର ଅଧିକ୍ୟ ଅଧିକ୍ର ଅଧିକ୍ୟ ଅଧିକ୍ର ଅଧିକ୍ର ଅଧିକ୍ର ଅଧିକ୍ର ଅଧିକ୍ୟ ଅଧିକ୍ୟ ଅଧିକ୍ୟ ଅଧିକ ଅଧିକ୍ର ଅଧିକ ଅଧିକ୍ୟ ଅଧିକ୍ୟ ଅଧିକ ଅଧିକ୍ୟ ଅଧିକ ଅଧିକ ଅଧିକ୍ୟ ଅଧିକ୍ୟ ଅଧିକ୍ୟ ଅଧିକ

પતિલંદાની નેગેરિવ અઅ થશેઃ દિનેશ નાવડિયા

હેવાં: દિનેશ નાવડિયાં હીરા ઉદ્યોગના અમાશી હિંમા નાવડિયાંમે જ્યાંવાનું હતું કે, માસ્ટનને લાગેલાળો નથી સુધી ખાસ કહીને ડામારેડ કબ્ડસ્ટ્રીને સાલ્યોગ કંપનીનો પ્રદ કરતો, માર્ચન પણ સ્વારાનો કંપ્રેલ હતો, પરંતુ જ સેવન અને અમેરિકાના પ્રદિવ છીને પરંતુ જ સેવન અને અમેરિકાના પ્રદેશ છીને પાસ્તિ કર્યો કરતો છે, તે મહિલા પાર્ટલ થીડી રહત આવામાં આવી હતી. પાર્ટલ થીડી રહત આવામાં આવી હતી. પાર્ટલ થીડી રહત આવામાં કદમ થયા વર્ચ હતા તે, તે લાકો અમદર છે, તે અમેરિકાને કોર્યા અમેરિકાને કામમાં કામમાં કે અમેરી પાર્ચકારી સ્થાવી પડલે. તેનો મેગેરિકા અસ્ત્રક સુરતના ક્રીલ ઉદ્યોગ (પરલે. તેનો મેગેરિકા અસ્ત્રક

પાસેથી ઈમ્પોર્ટ કરવા પડે છે. એટલે અડમાં કેરેટલી માંડીને પાતળી સાઈઝના જે પણ હીરા જ્વેલરીમાં ઉપયોગમાં લેવાયો હશે તે જ્વેલરી પણ અમેરિકામાં

ARFIN INDIA LIMITED

સંજેલીના ટીસાના મુવાડા સ્કૂલના છાત્રો ઓટલા પર બેસીને ભણવા મજબર

🎟 ાનોદ જિલ્લાના સંજેલી તાલુકાના ટીર મુવાડા માં સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ અને એક માટ લાઉન્ડ યુપાંડા અને એક ખાલ વારિકા ચાલે છે, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ો થી 8 પોરણ વચ્ચે કક્ત 4 જ ઓરડ બાકીના ચાર કલાસના બાલવાટિકાના સહિતના બાળકો ઓટલા પર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડી માં બહાર ખેતી અભ્યાસ કરવા મજબૂર બન્યા ત્યારે વાલીઓ પોતાના બાળકોને ભવિષ્યની ચિંતા સાથે શાળાના નવીન ઓરપ્ર બનાવવાની માંગ

સંજેલીના ટીસાના મુવાડા પ્રાથમિક શાળામાં નાગકોને સુવિધાને બદલે દુવિધા આપી રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે. સ્કૂલમાં 200 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગ્રાપ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સાલામાં



ઓરડાના અભાવના કારણે બહાર ઓટલ પર બેસી અગ્યાસ કરવા મજબૂર બન્યા છે ત ઓરણ અને ાથી શધોરળ અને એક બાલવાટિકા સહિતના 200 જેટલા બાળકો શિયાળાની ડેડીમાં પક્ષ બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર ભન્યો છે.આ સમસ્યાને લઈને આ તાલુકા સહિત ઇચ્ચ કક્ષાએ પણ પારદાર રજુઆત કરીછતાં પણ તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓના શિલણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ એક કાને સાંભળે અને બીજા કાને કાઢી નાખતા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી

4 ઓરડામાં 1થી 8 વર્ગ અને બાલ વાટિકા સહિતનાં 200 જેટલાં બાળકો અભ્યાસ કરે છે

છે. ગ્રામજન ભરતભાઈ ચારેલના જણાવ્યા અનુસાર સંજેથીના ટીસાના મુવાડ સ્કૂલના બાળકો ઓટલા પર બેસી બહાવા મજબૂર નિશાળની જમીન ફાળવવા માટે શિક્ષણ શાખા, તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર, સંજેલી પંચાયત,સહિત ઉચ્ચ ક્લાએ લેખિત રજૂઆત કરાઈ તેમજ ટીશાના યુવાડામાં સ્કૂલ માટે જમીન ફળવા માટે ગ્રામસભા પણ યોજાય

હતી પણ જમીન માટે દરખાસ્ત કરાઈ નથી આચાર્ય નટવરભાઇ ટી. રાકોડના જણાવ્યા અનુસાર અમારી શાળામાં ૧૦૫ કુમાર ૯૫ કન્યા અને એક બાલવાટિકા ચાલે છે. ધોરણ 1,2,4,7 અને બાલ વાટિકાના વિદ્યાર્થીઓ ઓરવના અભાવના કરણે બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરે છે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓને રજુઆત કરેલ છે કે એક વર્ષ ઉપરાંતથી બાળકો બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરે છે.

લોકસભા ચૂંટણી પૂર્વે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ

» બન્નેના પોત પોતાના પક્ષના વિજયના દાવા

નવગુજરાત સમય > રાજપીપળા

■જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠક પર રાજકારણ ગરમાઈ રહ્યું છે.લગ્ન પ્રસંગોમાં ડીજે સિસ્ટમમાં અત્યારે મનસુબ વસાવા અને ચૈતર વસાવાના જ ગીતો વાગી રહ્યા છે.તો બીજી બાજુ વનકર્મીઓને માર મારવાના ગુનામાં જેલમાંથી છટીને આવેલા ચૈતર વસાવાએ ચુંટલી પ્રચારે દરમીયાન જબ તક તોડેંગે નહિતબ તક છોડેંગે નહિ, મેં ગુકેગા નહિ. સહિતના ફિલ્મી ડાયલોગ સાથે ભાજપ પર ગંભીર આશેપો લગાવ્યા હતા.ત્યારે હવે ચૈતર વસાવા અને મનસુખ વસાવા

મનસુષ્વસાવાએજઘાવ્યું હતું કે આવી ફિલ્મી સ્ટાઈલથી પ્રચાર ચાલુ કરનારા કોઈ દિવસ ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી. ભરૂચ લોકસભા જતવા માટે અમે કોઈ પણ બીજી પાર્ટીને ગાળો દેતા નથી અમે જીતવાના જ છે. મારી પણ ભરૂચ લોકસભા જીતવાની તૈયારી છે પછી પાર્ટ લાક્સભા જીવનામાં તપાસ છે પછ પાટ જે નક્ક્રી કરે અને જેને પણ ટિક્ટિટ આપે તેને પણ ભટ્ટ્ય લોકસભા જીતાડવાની સંપૂર્ણ તૈયારી છે. કોંગ્રેસ અને આપ ગમે

તેવા ગુંડ કે યમરબંધીને ચૂંટલીમાં ઉતારશે તેને હરાવવા માટે ભાજપ સંગઠન તૈયાર છે. અમે કોઈની લીટી ભૂંચવામાં નહીં અમારી લાંબી કરવા માંગીએ છે.2024 ની લોક્સભા ચૂંટલીમાં જેની હાલમાં કેન્દ્રમાં સરકાર છે તે જ ગાલશે.ચંટણી ભાગતે પાર્ટીએ જે ઈશારો કરવાનો હતો તે પાર્ટીના કાર્યક્રરોને ઈશારો કરી દીધો છે.

આજથી ડાકોરમાં ફ્લડોલ ઉત્સવ રણછોડરાયજી રંગોત્સવમાં રંગાશે

🔳 જાણીતા યાત્રમધામ ડાકોરમાં રાજધિરાજ રવાઇડડાય આજવી ફ્લડોલ ઉત્તવના સંગે 40 પ્રભુ સન્મુખ વસ્તુનો કળશનું અધિવાસન અને દિવસ પ્રભુ ત્રજ ભક્તો સાથે હોળી ખેલશે. પુન્દિમાર્થ સ્થાન भेवामां आ का हिवस

પ્રભુને રંગોથી ખેલાવાવામાં આવે છે. શ્વેત વસ્ત્રો પર અલગ અલગ રંગથી હોળી ખેલેલા પ્રભુની શોભા કંઇક વસંત પંચમીથી મતા

સુદ ચૌદસના 10 દિવસો 🛣 વસંત ખેલના અને બાદમાં પક્ષાં ભવાય કરા કોટમાં પૂર્ણિયાથી ડોલ ઉત્સવના 31 દિવસો ધમાર ખેલના હોય છે. પમાર શરૂ થતાં જ વ્રજ ભક્તો પ્રભુને મીઠી ગારી આપે છે. જાત જાતના કીર્તન પદ રસિયા ગાઈને પ્રભને રીઝવે છે. વસંત પંચમી

ઉત્સવ હોઈ શ્રીજીને મંગળા સફેદ સનેરી કિનારી વાળા સાજ વસ્ત્રો, શ્રી મસ્તક પર કુલેહ જોડ ચંદ્રિક્ષ તેમજ આયુપો સહિત મૃગાર. શૃગારમાં

> દેદીપ્યમાન રાજાપિરાજની શોભા જ કંઈ અનેરી હોય છે. શ્રી રક્ષ્ક્ષોડેસ્થય મહારાજની ખેલના આ તા દિવસોમાં શ્રી વક્ષસ્થળ પર 'X' આકાર નો સોનાનો વિશેષ દાગીનો ' હમીર ' પરાય છે. તેમજ લાલ સફેદ કપૂર માળા, કસ્તુરી ચોવાની શ્યામ કંઠી આ ત્ર**શ**

આભ્યશ નિયમ થી ધરાય છે. ખેલ બાદ શ્રીજ મતારાજ ખેલ ભોગ જેને ફગુવા ધરાય છે, જેમાં ધી તેજાના યુક્ત ખજૂર, ધાણી ચણા અને સૂકો

४ महिनाथी टाउन પ્લાનરના અભાવે છોટાઉદેપરમાં અનેક કામો અટક્યાં

નવગુજરાત સમય > છોટાઉદેપુર

...છોટાઉદેપુર નગરપાલિકામાં નિષમિત ટાઉન પ્લાનર ન હોવાને કારણે પ્રજાના મકાનો ના કામ અટકી ગયા છે. નવી આકારણી કરાવી મકાનો માટે રજા ચિક્રી લેવી બેન્ક લોન જેવી ઘણી બધી મહત્વની શ્રમગીરી અટવાઈ જવાને કારણે લોકો મુશ્કલીમાં મૂકઈ ગયા છે. ટાઉન પ્લાનિંગ માટે અગાઉના ટાઉન પ્લાનરની બદલી થઈ ગઈ હોય જ્યારે તાલમાં કોઈ કાયમી નિમણુક કરવામાં આવી નથી અને જેના કારકો પ્રજા એ ઓટા મારવાનો વારો આવી ગયો છે. પાલિકામાં છેલ્લા સાર મહિનાથી ટાઉન પ્લાનર નથી. જેના કારણે 168 જેટલી કાઈલો લોકોની પેન્ડિંગ છે.

AHMEDABAD MUNICIPAL CORPORATION (ENGINEERING TRAFFIC PROJECT DEPARTMENT) TENDER NOTICE NO:- 98/2023-24/01

Name of Work: Different kind of Traffic Allied

work. 01 Online Tender Date: 05/03/2024 Submission up to: UP TO 17.00 HRS Details & Tenders www.tender.nprocure.com Available On:



TENDER NOTICE or for the following from eig & printing work items, he g printing water ispitality material, plumbing material, carpentern lywood, floor/bathroom:deaning material, sport water out at Raipeth Club Limited, Ahmedebad

Mishal I. Pat

અમદાવાદથી રાજપીપળા પરત ફરતી જાનના જાનૈયાઓને ફડ પોઈઝનિંગ થતાં દોડધામ

» 35 જાનૈયાઓને નડિયાદ સિવિલમાં સારવાર અપાઇ

નવગુજરાત સમય > નડિયાદ

____રાજપીપળાલી -નીકળીને અમદાવાદ જાન લઈને ગયેલી એક બસ લગ્ન પ્રસંગ પતાવીને પરત કરતી હતી. ત્યારે એકાએક એક્સપોલ હાઈવે પર નડિયાદ પાસે જાનૈયાઓને ઝાડા-ઉલટી થતા તાત્કાલિક અસરથી ન પિયાદની હોસ્પ્રિટલમાં ૧૬ જ્યાને નાડમાંકના શાસ્ત્રટથમાં ૩૦ જરાન સારવાર આપવામાં આવી હતી. સારવાર આપ્યા બાદ સૌને પોતાના ગંતવ્ય સ્થળે હેમખેમ મોક્લીને તંત્રએ લાશકારો અનુભવ્યો હતો. આ ઘટનાના પગલે પગલે વર પક્ષ અને કન્યા પદ્મમાં ભારે દોડપામ મચી

અરા કરવા પવારા ભાર અડગામ મચા ગઈ હતી. રાજપીપળા ગામેથી એક બસમાં 55 જેટલા જાનેયાઓ લઈને બસ અમદાવાદ લગ્ન પ્રસંગે ગઈ હતી, અમદાવાદમાં લગ્નપ્રસંગ પતાવીને સૌએ આનંદપૂર્વકનું ભોજન મારધું હતું, આ ભોજનમાં તેઓએ પંજામી સબ્જી, હલવો, સહિતની અનેક વાનગીઓ માણવાની સાથે દધને રાજપીપળા તરક રવાના કરાયા હતા



કોલ્ડ્રીક્સ પણ પીધું હતું, ત્યારબાદ સૌ એકબીજાને મળીને તેમખેમ પરત કર્યા હતા. જાનમાં પરત કરતા સૌ જાનેય ભાઈ-બહેનો આનંદપૂર્વક મોજમસ્ત કરીને સમય પસાર કરતા હતા. ત્યારે એકાએક જ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં સૌને ઉલટીઓ થવા લાગી હતી. પીમેપીમે તેનું પ્રમાણ વધતુ જતા આ બસને નડિયાદ પાસે રોકી લઈને 108 સારવાર માટે ફોન કરવામાં આવ્ય हता. होन भणता ४ १०६ नी अप એમ્પ્યુલના વાન નડિયાદ એક્સપ્રેસવે ના ડાકોર એક્ઝીટ પાસે પહોંચી ગઈ હતી.જ્યાંથી સૌ જાનૈયાઓને 100 માં મેસાડીને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી, જેના પરિણામે કોઈ ગંભીર ઘટના બની ન હતી અને હો જાનમાં આવેલાએ સહત અનભર્વ હતી. વહેલી સવાર સુધી સૌને સ આપીને જાનૈયાઓને હે

આક્રિન ઈન્ડિયા લિમિટેડ

ર**જિસ્ટર્ડ અને કોર્પોરેટ ઓફિસ** : પ્લોટ નં. ૧૧૭, રવિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પ્રેસ્ટીજ હોટલની પાછળ, બિલેશ્વરપુરા, છત્રાલ, ગાંધીનગર - ૩૮૨૭૨૯, ગુજરાત, ભારત

CIN: L65990GJ1992PLC017460 क्रोन : +६٩ २७६४ २३२६२٩ होमेर्डाच : investors@arfin.co.in, वेजशार्धर : www.arfin.co.ir

39 ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટર અને નવ મહિના અનઓડિટેડ નાણાંકીય પરિણામોના નિવેદનનો અર્ક (₹ પ્રતિ શેર ડેટા સિવાય લાખમાં)

9H	વિગતો	ક્વાર્ટર સમાપ્ત		नव भढ़िना सभाप्त	
		34-45-5053	34-45-5055	39-92-2023	39-92-2022
		(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(अनमोडिहेड)	(અનઓડિટેડ)
9	કામગીરીમાંથી આવક (GST સહિત)	93,356.62	43,532.28	85,983.36	38,930.35
2	સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન) (કર પહેલાં, અપવાદરૂપ અને / અથવા અસાધારણ વસ્તુઓ)	293.49	836.38	696.98	98.89
3	કર પહેલાંના સમયગાળા માટે ચોખ્ખો નફો / (નૂકશાન) (અસાધારણ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	293.45	836.38	₩ 5€.98	963.86
a	કર પછીના સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન) (અસાધારણ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	962.64	£30.43	908.04	892,42
ч	સમયગાળા માટે કુલ વ્યાપક આવક (સમાવિષ્ટ નફો / (નુકસાન) સમયગાળા માટે (કર પછી) અને અન્ય વ્યાપક આવક (કર પછી)	966.64	230.43	908.04	હ૭૨.૫૨
Ę	પેઇંડ અપ ઇક્લિટી શેર કેપિટલ (પ્રત્યેક ₹1/- ની ફેસ વેલ્યુ)	9,466.28	89.954,9	9,466.28	9,466.28
0	અન્ય ઇક્વિટી (અનોડિટેડ બેલેન્સશીટમાં દર્શાવેલ રિવેલ્યુએશન રિઝર્વ સિવાય)	12	(7)	2	7
4	શેર દીઠ કમાણી (અસાધારણ વસ્તુઓ પહેલાં અને પછી) (પ્રત્યેક ₹1/- ની ફેસ વેલ્યૂ)				
	मूणभूत (र)	0.93	0.94	0.36	98.0
	ਮਿ ਲ ਰ (₹)	0.93	0.94	0.36	98.0

जींध : ઉपरोક्त SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિક્લાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરાયલે ત્રિમાસિક/ વાર્ષિક નાશાંકીય પરિણામોના વિગતવાર કોર્મેટનો એક અર્ક છે. ત્રિમાસિક નાશાંકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ <u>www.bseindia.com</u> લિમિટેડની વેબસાઈટ <u>www.arfin.co.in.</u>

आर्क्टिन वंडिया सिमिटेंड भाटे

મહેન્દ્ર આર. શાહ અધ્યક્ષ અને સંપૂર્ણ સમય નિર્દેશક, (DIN: ૦૦૧૮૨૭૪૬)

અને કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. जोर्ड ओह डायरेहरूरजी वती

તારીખ: ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪